

ખેડબ્રહ્મા નગર પાલિકા સામાન્ય શરતો

૧. પરત આવેલ ઈ – ટેન્ડરો પૈકી કોઈપણ ટેન્ડર કોઈપણ કારણસર આપ્યા સિવાય સ્વીકારવું, રદ કરવું, કોને આપવું અને ક્યા ભાવથી આપવું તેમજ મંજૂર કે ના મંજૂર કરવાની સત્તા ખેડબ્રહ્મા નગરપાલિકાને આબાધીત રહેશે.
૨. શરતી ટેન્ડર સ્વીકારવામાં આવશે નહીં.
૩. ટેન્ડર સાથે ૧% મુજબ અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ ડીડી/એફ.ડી.આર થી મોકલવાની રહેશે અર્નેસ્ટમની ડીપોઝીટની રકમ વગરના ટેન્ડર માન્ય ગણાશે નહીં. તેમજ એક્ઝામિનેશન સર્ટીફિકેટ પણ માન્ય ગણાશે નહીં.
૪. કામ મંજૂર થયેથી ૨.૫% મુજબ સીક્યોરીટી ડીપોઝીટની રકમ ડીમાન્ડ ડ્રાફ્ટથી ખેડબ્રહ્મા નગરપાલિકામાં જમા કરાવવાની રહેશે તથા ૨.૫% મુજબ સીક્યોરીટી ડીપોઝીટની રકમ બીલમાંથી કપાત કરવામાં આવશે.
૫. ૩% મુજબ પર્ફોમન્સ બોન્ડ એફ.ડી.આર નેશનલાઈઝ બેંક/ શીડયુલ બેંકનો આપવાની રહેશે. આ બોન્ડ ઓછામાં ઓછો ૩ વર્ષની મુદત માટેના આપવાના રહેશે. (રૂ.૩૦.૦૦ લાખ ઉપરના કામો માટે)
૬. કામ કરવા માટે જરૂરી સાઈડ સફાઈ તેમજ અન્ય જવાબદારી કોન્ટ્રાક્ટર/ એજન્સીની રહેશે.
૭. ચાલુ કામે તકરાર યા મતભેદ પડશે તો ટેન્ડર મંજૂર કરનાર ઓથોરીટી જે નિર્ણય લેશે તે નિર્ણય કોન્ટ્રાક્ટર/ એજન્સીને આખરી અને બંધન કર્તા રહેશે તેમાં કોઈ દાદ કે ફરીયાદ ચાલશે નહીં.
૮. ટેન્ડર મંજૂર થયેથી સરકારી નિયમ મુજબના ઈન્ડમટેક્સ,ટેસ્ટીંગ ફી તથા અન્ય ચાર્જ બીલમાંથી કપાત કરવામાં આવશે.
૯. ટેન્ડર મંજૂર થયેથી સરકારી નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટીનો સ્ટેમ્પ તેમજ એગ્રીમેન્ટ માટેનો નોન જયુડીશીયલ સ્ટેમ્પ કોન્ટ્રાક્ટર/ એજન્સીએ રજુ કરવાનો રહેશે.
૧૦. ટેન્ડરના ભાવમાં કોઈ ભાવ વધારો કે ભાવ ફેર કરી આપવામાં આવશે નહીં.
૧૧. ટેન્ડરના કામમાં વધારો કે ઘટાડો કરવાની તેમજ અન્ય એક્સ્ટ્રા આઈટમ કરવા તથા ટેન્ડરની કોઈ આઈટમ જરૂરી જણાયે રદ કરવાની સત્તા ટેન્ડર મંજૂર કરનાર ઓથોરીટીની રહેશે જેમાં કોઈ પ્રકારના વળતરની કે હકદાવાની માંગણી કરી શકાશે નહીં.
૧૨. સીક્યોરીટી ડીપોઝીટ પેટે ટેન્ડર મંજૂર થતા ભરેલ ૨.૫% મુજબની રકમ અને બાકીની ૨.૫/ મુજબની બીલમાંથી કપાત કરેલ સીક્યોરીટી ડીપોઝીટની રકમ કામ પુર્ણ થયા ની તારીખથી ૩ વર્ષ બાદ પરત ચુકવવામાં આવશે.
૧૩. ખેડબ્રહ્મા નગરપાલિકા ધ્વારા કામગીરી દરમ્યાન વખતો વખત જે સુચનાઓ આપવામાં આવે તેનો ચુસ્તપણે કોન્ટ્રાક્ટર/ એજન્સીએ અમલ કરવાનો રહેશે.
૧૪. કામગીરી દરમ્યાન સાઈટ ઉપરની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર/ એજન્સીની રહેશે.
૧૫. મુજસત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા/અથવા માર્ગ અને મકાન વિભાગના નિયમોની તમામ શરતો ટેન્ડરમાં લાગુ પડશે અને તે કોન્ટ્રાક્ટર/ એજન્સીને બંધન કર્તા રહેશે. કામગીરીની કવોલીટીની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર/ એજન્સીની રહેશે.
૧૬. જો કામગીરી ગ્રાન્ટની હશે તો તેના આદેશમાં જણાવેલ અનુસારની શરતો, વિગતો, નિયમો વિગેરેનું પાલન કોન્ટ્રાક્ટર/ એજન્સીએ કરવાનું રહેશે તેમજ જેમ – જેમ ગ્રાન્ટના હપ્તા રીલીઝ કરવામાં આવશે તે પ્રમાણે કામગીરીના બીલનું ચુકવણું કરવામાં આવશે.
૧૭. ફોર્મ – બી ની શરતો બંધન કર્તા રહેશે કામ મુજસત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા/અથવા માર્ગ અને મકાન વિભાગ,ગુજરાત રાજ્યના જનરલ ટેકનીકલ સ્પેસીફિકેશન ઓફ મટેરીયલ્સ,રોડ તેમજ બિલ્ડીંગ વર્કસની બુક મુજબ અનુસરવાનું રહેશે. તથા નગરપાલિકાની તેમજ નગરપાલિકાના આ કામના કંસલ્ટન્ટની સુચના પણ સાઈટ ઉપર ચાલુ કામે ધ્યાનમાં લેવાની રહેશે.
૧૮. કોઈપણ કાયદાકીય લીટીગેશન ખેડબ્રહ્મા શહેરની કોર્ટમાં રહેશે.
૧૯. ઓફર અથવા ટેન્ડરમાં દર્શાવેલ આઈટમનો જથ્થો સંભવીત જથ્થો છે જેમાં ચાલુ કામ દરમ્યાન ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
૨૦. લેબર એક્ટ પ્રમાણે રજીસ્ટ્રેશન અંગે અમલ કરવાનો રહેશે જો તે મુજબની કાર્યવાહી નહીં થઈ હોઈ તો તે માટે કોન્ટ્રાક્ટર/ એજન્સી સંપૂર્ણ પણે જવાબદાર રહેશે.
૨૧. જીએસટી કે અન્ય કોઈપણ સરકારી કરવેરા ભરવાની જવાબદારી કોન્ટ્રાક્ટર/ એજન્સીની રહેશે.
૨૨. ચાઈલ્ડ લેબર એમ્પ્લોઈ કરી શકાશે નહીં તે માટે કોન્ટ્રાક્ટર/ એજન્સી સંપૂર્ણ પણે જવાબદાર રહેશે.
૨૩. કોઈપણ કારણસર ટેન્ડર રદ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર/ એજન્સી તે અંગે કોઈપણ પ્રકારનો હક દાવો કે વળતરની માંગણી કરી શકશે નહીં.
૨૪. રાજ્ય/ કેન્દ્ર સરકારશ્રીના વખતો વખતના કાયદા મુજબ જે કોઈ રકમની કપાત કરવાના હુકમ સરકારશ્રી કરશે તે મુજબ કોન્ટ્રાક્ટર/ એજન્સીના બીલમાંથી કપાત કરવામાં આવશે.
૨૫. લેબર વેલ્ફેર ફંડ માટે રાજ્ય સરકારશ્રીના હુકમ મુજબ ૧% રકમ બીલમાંથી કાપી લેવામાં આવશે.

૨૬. આ કામના મ્યુનિસિપલ ઈજનેરની સુચનાઓ, માર્ગદર્શન, ડ્રોઈંગ તેમજ તેમના ધ્વારા આપવામાં આવે તે ડીટેઈલ વિગતો મુજબ એજન્સીએ કામગીરી કરવાની રહેશે,
૨૭. સ્થળ પરિસ્થિતી/ જરૂરીયાત મુજબ કામ કરાવતા ટેન્ડરમાં જણાવેલ કોન્ટ્રાક્ટમાં વધ - ઘટ થશે તો તે અંગે કોન્ટ્રાક્ટર/ એજન્સી ધ્વારા કોઈપણ પ્રકારની વધારાની નાંણાકીય માંગણી કરી શકશે નહીં અને કામ ઓછું થાય તો કોન્ટ્રાક્ટરની વળતરની માંગણી સ્વીકારવામાં આવશે નહીં.
૨૮. ચાલુકામ દરમ્યાન પ્રોટેક્શનની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર/ એજન્સીની રહેશે અને કોઈપણ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. કામ દરમ્યાન ટેલીફોનના કેબલ તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકાની પાઈપ લાઈન કે અન્ય કોઈપણ ઈસમોની માલમિલકત, પાણી કનેક્શનો, દટણમાળ વગેરેની નુકશાની ઈજારદારે સ્વખર્ચે ભોગવવાની રહેશે.
૨૯. કોઈપણ કારણસર જો કોન્ટ્રાક્ટર/ એજન્સીને કામ ન આપી શકાય તો તે અંગે કોન્ટ્રાક્ટર/ એજન્સી કોઈપણ પ્રકારનો નુકશાની - વળતરનો હકક દાવો કરી શકશે નહીં કે કાયદાકીય કાર્યવાહી આ અંગે થઈ શકશે નહીં ટેન્ડર મંજૂર થયાનો અર્થ કામ આપીજ દેવાનું છે તેવો થઈ શકશે નહીં.
- ૩૦.
- ૩૧. રોડનું કામ ચાલુ કરતા પહેલા હયાત રસ્તાનો ઢાળ તેમજ તેના લેવલ સર્વેયર પાસે ટી.એસ થી કરાવવાનું રહેશે તેમજ નવીન રસ્તા માટે જરૂરી સ્લોપ મુજબના માર્કિંગ કરાવી આગળનું કામ કરાવવાનું રહેશે.**

ઉપરોક્ત તમામ શરતો તથા નિયમો અમોએ ટેન્ડર ભરતા પહેલા કાળજી પુર્વક વાંચ્યા છે અને અમોને તેમજ અમારા વહીવટ કર્તાઓને કબુલ મંજૂર અને બંધન કર્તા છે તેમજ રહેશે.

કોન્ટ્રાક્ટર/એજન્સીની સહી

ચીફ ઓફીસર
ખેડબ્રહ્મા નગરપાલિકા